

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૦૮/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૮૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૩ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી ૨૦૯ લીટર દેશી દારૂ અને ૦૩ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૬ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૩,૯૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૮૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૦ વ્યક્તિઓની તેમજ પ્રો.વી.૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૫૮૫/૧૬

સરદારનગર: કૈલાસબહેન બળદેવભાઈ પરમાર (રહે.ખોડીયારનગર, નવી વસાહત, નોબલનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૮/૧૬ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી પોતાની પુત્રી કાજલબહેન (ઉ.વ.૧૫) ને આરોપી અસ્વીન ઉર્ફે શની ઇજેસિંહ રાજપુત (રહે.રાજેન્દ્રપાર્ક અર્બુદાનગર, ઓઢવ) લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ઝેડ.એમ.સિંઘી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૮૬/૧૬

જી.આઇ.ડી.સી.વટવા: તેજસભાઈ વસંતલાલ દિક્ષીત (રહે.વાસુદેવ બંગલોઝ ઉમંગ એપાર્ટમેન્ટ સામે જસોદાનગર) એ જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૮/૧૬ કલાક ૬/૦૦ થી તા.૨૯/૮/૧૬ કલાક ૮/૦૦ વાગ્યા દરમિયાન પોતાની મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ૮૫,૨૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી એન વાઘેલા ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૫૮૭/૧૬

નિકોલ: મમતાબહેન હસમુખભાઈ સોલંકી (રહે.કે પી રેસીડન્સી નિકોલ ગામ) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૮/૮/૧૬ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે મમતાબહેન પત્રકાર હોઈ કઠવાડા નિકોલ જીઆઈડીસી રોડ નંબર-૧૫ ખાતે કોઈ વિડીયો શુટીંગ કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો મારા મારી કરી સોનાની લક્કી અને સોનાની ચેઈન મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર જી ખાંટ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૫૮૮/૧૬

સોલા હાઈકોર્ટ: ડીમ્પલ અંકુરભાઈ બારોટ (ઉ.વ.૨૬) (રહે.સિધ્ધીદાતા આવીકા એપાર્ટમેન્ટ વંદે માતરમ આઈકોનની પાછળ ગોતા સોલા) તા.૨૫/૮/૧૬ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે સોલા ગોતા લાઈફ લાઈન હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ડીમ્પલ બારોટના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા.આ અંગેની ફરીયાદ ડીમ્પલ બારોટે તા.૨૯/૮/૧૬ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ આર મેઘાણી પોલીસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.